

પ્રાટ અને બાધકામ બચે (રૂ)

બેંક ખાતાની વિગતો

	અરજદાર	સહ-અરજદાર
બેંકનું નામ		
ખાતાનો પ્રકાર	☐ બચત ☐ ચાલુ ☐ ઓવરડ્રાફ્ટ	☐ બચત ☐ ચાલુ ☐ ઓવરડ્રાફ્ટ
ખાતા નંબર		
IFSC કોડ		
શાખાનું નામ		
લોનની પુનઃચકવણીની રીત	☐ NACH/SI ☐ SI ☐ રોકડ	
પરિવારની માહિતી અને પરિવારની આવકની ઘોષણાં		

નામ	વય	અરજદાર સાથેનો સંબંધ	ID પ્રકાર	ID નંબર	શૈક્ષણિક સ્તર	NGP*	વ્યવસાય	આવક/ યોગદાન	આરોગ્ય (H/U/D)**

માત્ર ઓફિસના ઉપયોગ માટે

મારફતે અરજી	ગ્રાહકને સંદર્ભ આપનાર ☐	USFB સ્ટાફ ☐	અન્ય
પ્રોસેસિંગ ફી ☐			
રૂમાં રકમ	રોકડ ☐	ચેક ☐	ઓનલાઈન ☐
			ચેક નંબર
			તારીખ
સંદર્ભ આપનારનું નામ		રેફરર આઈડી:	
લોન અધિકારી		એમ્પ્લોય ID: UJJ	
લોન અધિકારી		એમ્પ્લોય ID: UJJ	
કારોબાર તરફથી મંજૂર કરનાર		એમ્પ્લોય ID: UJJ	
કેડિટ તરફથી મંજૂર કરનાર		એમ્પ્લોય ID: UJJ	

પ્રોડક્ટની વિશેષતાઓ

પ્રોડક્ટનો પ્રકાર	લોન રકમ (₹ લાખમાં)	અવધિ (મહિનામાં)	અન્ય
વિકાસ લોન	₹2થી ₹10 લાખ	24 – 84 મહિના	લોગિન ફી: ₹3000/- + GST પ્રોસેસિંગ ફી: 2% + GST
વિકાસ લોન BT	₹2થી ₹10 લાખ	24 – 84 મહિના	સીઈઆરએસએઆઈ શુલ્ક) 5 લાખ સુધી (₹50/-) 5 લાખથી વધુ (₹100/-)

લોન અરજીની સ્વીકૃતિ

ઉજ્જવન એસએફબી લિમિટેડ (યુએસએફબી) _____ પાસેથી લોનની અરજી પ્રાપ્ત કરી હોવાનું સ્વીકારે છે. અમે આ અરજી અંગેનો અમારા નિર્ણય અંગેની જાણ તેના 30 દિવસની અંદર કરીશું. પ્રોડક્ટની વિશેષતાઓ અમારી વેબસાઈટ (<https://www.ujjivansfb.in/personal/loans/vikas-loan>) પર ઉપલબ્ધ છે. કૃપા કરીને જાણકાર રહો કે આ અરજીને બેંકની નીતિ અને નિયમનકારી ધોરણોને આધિન પીએસએલ હેઠળ વર્ગીકૃત કરવામાં આવી શકે છે.

લોન અધિકારીનું નામ

સહી

તારીખ

- લોનની મંજૂરી ઉજીવન સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ (હવે પછી “બેંક”)ના એક માત્ર વિવેક પર આધાર રાખે છે. બેંક કોઈ પણ કારણ આપ્યા વિના મારી/અમારી અરજીને નામંજૂર કરી શકે છે. બેંક મારી/અમારી વધુ ધિરાણની આવશ્યકતાને ભંડોળ પૂરું પાડવા માટે બાધ્ય નથી. જ્યાં સુધી હું/અમે લાગુ થવા પાત્ર નિયમો અને શરતોનું પાલન ન કરીએ ત્યાં સુધી, મંજૂર થઈ હોવા છતાં પણ બેંકે લોન ડિસ્બર્સ કરવી આવશ્યક હોતી નથી.
- અ) નિયમો અને શરતો તથા લોનને સંચાલિત કરતા શુલ્ક અને ફી દ્વારા બાધ્ય રહીશું. હું/અમે એક સમયાંતરે નિર્દાશિત કરી શકે એવા નિયમો અને શરતોથી પણ બાધ્ય હોઈશું. બેંક પોતાના વિવેકથી પોતાના વિવેકથી સમયાંતરે નિયમો અને શરતો, શુલ્ક અને ફી સમયાંતરે બદલવા, સુધારવા અથવા ફેરફાર કરવા માટે અધિકૃત છે. આ માટે વેબસાઈટ (www.ujjivansfb.in) પર અને/અથવા કોઈ શાખા પર પ્રકાશિત કરવામાં આવતી મુદતનાઓ મારા/અમારા માટે પર્યાપ્ત સૂચના હશે હું/અમે તેનાથી બાધ્ય રહીશું.

મ) હું/અમે વાસ્તવિક માલિક/સંયુક્ત અથવા ઘણા માલિક છીએ અને હું/અમે અહીં ઉલ્લેખ કરેલી સ્થાવર સંપત્તિનો સંપૂર્ણ કબજો ધરાવીએ છીએ. હું/અમે જણાવેલી સંપત્તિ માટે મારી/અમારી સ્પષ્ટ, માન્ય, માર્કેટિંગ યોગ્ય અને બોજ વિનાના શિર્ષક અંગેના પૂરતા દસ્તાવેજ પુરાવા રજૂ કરીને બેંકને ખાતરી આપીશું.

હું/અમે બેંકને કોઈ પણ વૈધાનિક/નિયમનકારી સંસ્થાઓ અથવા નાણાકીય સંસ્થાઓ અથવા ફેડેરે બ્યુરો/ એજન્સીઓ અથવા બેંકની પેરેન્ટ/ પેટાકંપની/ સહયોગીઓ/એસોસિએટ અથવા બેંક દ્વારા સામેલ અન્ય કોઈ ત્રાહિત પક્ષ અથવા એવા લોકો જેમની સાથે બેંક કોર્પોરેશન સંબંધ ધરાવે છે, આવશ્યક અથવા હોઈ શકે/ કાયદા, નિયમ અથવા નિયમન દ્વારા મંજૂરી આપેલ હોઈ શકે અથવા બેંક દ્વારા આવશ્યક સુચા પ્રમાણે, મારી/અમારી અથવા/મારા/અમારા ખાતા(ઓ) ને સંબંધિત (વ્યક્તિગત સંવેદનશીલ ડેટા/ માહિતી અને/અથવા અન્ય કોઈ માહિતી, જેના માટે હું/એમેશન ટેકનોલોજી દ્વારા, 2000 અને હું/એમેશન ટેકનોલોજી (વ્યાજગીર) કુચા પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ દ્વારા તથા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા અથવા માહિતી) નિયમ, 2011 અને/અથવા અન્ય કોઈ કાયદા) હેઠળ સંપત્તિની આવશ્યકતા હોય એવી અન્ય કોઈ માહિતી) કોઈ પણ અથવા તમામ માહિતી અને ડેટા, પછી તે મારા દ્વારા પૂરા પાડવામાં આવ્યા હોય અથવા અથવા, તેમનું આદાન-પ્રદાન, આપ-લે, જાહેર અથવા કરવા માટે અવિકૃત કરે હું અને હું/અમે બેંક અથવા તેના એજન્ટ્સ/ પ્રતિનિધિઓ/ કર્મચારીઓને આવી માહિતીનો ઉપયોગ કરવા/ આપ-લે કરવા માટે જવાબદાર ઠેરવીશ નહીં.

લેખિતામાં જાહેર કરેલ હદ સિવાય, ઠું/અમે નિર્દેશક અથવા બેંક અથવા અન્ય કોઈ બેંક કે વરિષ્ઠ અધિકારીના નિર્દેશકના સંબંધી અથવા બેંકના વરિષ્ઠ અધિકારીના સંબંધી નથી કે બેંકના કોઈ નિર્દેશક અથવા કર્મચારી અથવા વરિષ્ઠ અધિકારી અથવા તેમના સંબંધી મારા/અમારા દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિમાં કોઈ નોંધપાત્ર હિત ધરાવતા નથી.

કું/અમે ડિકોલ્ટર/ ઇચ્છાપૂર્વક ડિકોલ્ટર નથી અથવા ડિકોલ્ટર/ ઇચ્છાપૂર્વક ડિકોલ્ટર તરીકે જાહેર કરવા માટેની કોઈ કાર્યવાહીનો સામનો કરી રહ્યા નથી અને જો કોઈ ધિરાણકર્તા મને/અમને ઇચ્છાપૂર્વકના ડિકોલ્ટ જાહેર કરવા માટે કોઈ કાર્યવાહી શરૂ કરે છે અથવા ધમકી આપે છે તો બેંક મારી/અમારી સામે યોગ્ય કાર્યવાહી લેવાનો અધિકાર ધરાવશે.

બેંક અથવા તેના એજન્ટ્સ દ્વારા ટેલિફોન/ મોબાઇલ/ એસએમએસ/ ઇ-મેઇલ મારફતે વ્યવહાર, પ્રમોશન તેમ જ સેવા સંબંધિત કોલ્ડ અથવા મેસેજિસ માટે મારા/અમારા સંપર્કના નંબર/ઇ-મેઇલ આઈડીનો ઉપયોગ કરવા માટે બેંક અધિકૃત છે.

જો અહીં મારા દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતોમાં કોઈ ફેરફાર થાય છે તો હું/અમે બેંકને ટેકો આપતા પુરાવાની સાથે આવા ફેરફાર થયાના 2 (બે) સપ્તાહની અંદર આવા ફેરફાર અંગેની લેખિતમાં જાણ કરી શું અને ત્યાર સુધી બેંક લોનને સંબંધિત અહીં પૂરી પાડેલી માહિતીને સ્વીકારવા માટે અધિકૃત છે.

0) ઉપર પૂરા પાડેલા મોબાઇલ નંબર અને ઈ-મેઇલ એડ્રેસ મારા/અમારા વિશેષ નિયંત્રણમાં છે.

1) બેંક ડુ-નોટ કોલ રજિસ્ટ્રીઝમાં મારા/અમારા સંપર્ક નંબર (ડિ-રજિસ્ટર કરવા માટે અને મારા/અમારા સંપર્ક નંબરની ડીએનડી સ્થિતિ નિષ્ક્રિય/ડિ-રજિસ્ટર કરવા માટે પણ અધિકૃત છે. હું/અમે એ બાબતથી પણ જાગૃત છીએ કે હું/અમે બેંક ડીએનડી/એનડીએનસી સ્થિતિને નિષ્ક્રિય/ડિ-રજિસ્ટર કર્યા પછી મારા/અમારા વિવેક પર કોઈ પણ સમયે ડીએનડી/એનડીએનસી માટે પુનઃનોંધણી કરવાનો અધિકાર અને વિકલ્પ ધરાવીએ છીએ.

2) જો લોનની અરજી નામંજૂર થાય અથવા જેના માટે અરજી કરવામાં આવી છે તે લોન (જો મંજૂર કરેલ હોય) સમાપ્ત થાય તો બેંક અરજી સાથે મારા/અમારા દ્વારા રજૂ કરેલા ફોટોગ્રાફ અને દસ્તાવેજ મને/અમને પરત કર્યા વિના તેમને પોતાની પાસે રાખવા માટે અધિકૃત છે.

3) ઉપર સ્પષ્ટ કરેલી દરેક અને એકદ માહિતી મારા/અમારા સાથે સંબંધિત છે અને તે તમામ પાસાઓમાં સાચી, ખરી અને સંપૂર્ણ છે અને મેં/અમે કોઈ પણ માહિતી છુપાવી નથી. હું/અમે બેંકની વિનંતી પર, આવા વધુ દસ્તાવેજો, માહિતી, બાબતો અને વસ્તુઓ રજૂ કરીશું, જે બેંકને આવશ્યક લાગી શકે. હું/અમે મારા/અમારા પક્ષે કોઈ બેદરકારી/ ભૂલ અથવા મારા/અમારા પક્ષે કોઈ લાગુ થવા પાત્ર નિયમ અને નિયમનો અને/અથવા નિયમો અને શરતોનાં પરિણામ વગર અથવા બેંક, મારા/અમારા પક્ષે કોઈ પણ માહિતી પૂરી પાડવાને લીધે દરેક સંસ્કરણો, તમામ કાર્યવાહીઓથી અને સામે, માગણી, નુકસાન, ખર્ચ અથવા વ્યય, જે બેંકને કોઈ પણ સમયે થયા હોઈ શકે અથવા થાય છે તેના માટે બેંક, તેના સહયોગીઓ, નિયુક્ત ઉત્તરાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને ક્ષતિપૂર્તિ કરીશું અને કરતા રહીશું.

4) આધારના ઉપયોગ માટેની અધિકૃતતા

- o (બાયોમેટ્રિક માટે): હું/અમે બેંક સાથે ખાતું ખોલવા અથવા સુચનાઓની પ્રક્રિયાના ઉદ્દેશ માટે યુઝાઈડીએઆઈના માર્ગદર્શિકા અનુસાર અથવા સમયાંતરે લાગુ કરી ધારા કે કાયદા અનુસાર સ્વીકાર્ય હોય એ રીતે મારી/અમારી ઓળખ સ્થાપિત કરવા માટે અથવા કાયદેસરના ઓથોરિટી ઓફ ઈન્ડિયા ("યુઝાઈડીએઆઈ") સાથે પ્રમાણીકરણ કરવા માટે મારા/અમારા નંબર અને બાયોમેટ્રિક માહિતીનો ઉપયોગ કરવા માટે બેંકના સ્વૈચ્છિક સંમતિ આપું છું. બેંકને મારા/અમને જણાવ્યું છે કે મારા/અમારા આધાર નંબર અને (બાયોમેટ્રિક માહિતી જ્યાં સુધી કાયદા દ્વારા આવશ્યક કરવામાં આવ્યા મજૂરી આપેલ ન હોય ત્યાં સુધી અન્ય કોઈ ઉદ્દેશ માટે બેંક દ્વારા સંવૈચ્છિક આપ-લે/ ઉપયોગ કરવામાં આવશે નહીં. હું/અમે મારી/અમારી ઓળખ સ્થાપિત કરવા માટે ઉપલબ્ધ અન્ય રીત અંગે જાગૃત છું એટલે કે આધારની ઓફ-લાઈન ખરાઈ, પાસપોર્ટના અથવા અન્ય કોઈ સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજના ઉપયોગ. હું/અમે વધુ વૃષ્ટિ કરું છું કે આધાર મારફતે મારા/અમારા દ્વારા રજૂ કરેલ માહિતી સાચી અને ખરી છે અને હું/અમે મારા/અમારા દ્વારા પૂરી પાડેલી કોઈ ખોટી માહિતી માટે બેંકને જવાબદાર કેટલીશ નહીં.
- o (આધારની ક્રિડિટલ કોપી માટે): હું/અમે અહીં જાહેર કરીએ છીએ કે મેં/અમે બેંકમાં મારી/અમારી આધાર કાર્ડના સ્વૈચ્છિક રજૂ કર્યું છે અને બેંકને મારી/અમારા અથવા અન્ય અથવા સરનામાંના પુરાવા તરીકે તેનો ઉપયોગ કરવા માટે વિનંતી અને અધિકૃત કરી છે.

5) સેન્ટ્રલ કેવાયસી

હું/અમે બેંકને સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી અંગે ઉપર પૂરી પાડેલી વિગતો અપલોડ કરવા માટે અધિકૃત કરીએ છીએ. હું/અમે બેંકને કેવાયસી નંબરને આધારે સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી પાસેથી મારી/અમારી કેવાયસી વિગતો ડાઉનલોડ કરવા માટે પણ અધિકૃત કરીએ છીએ

“હું/અમે ઉજ્જવન સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડને વ્યવહાર/પ્રોત્સાહન/સેવા કોલ્સ/ મેસેજિસ માટે ફોર્મમાં ઉલ્લેખ કરેલ મારા/મારા સંપર્ક નંબરનો ઉપયોગ કરવા માટે અધિકૃત કરીએ છીએ.”

□ ୧୮ □ ୧୯

અરજદારનો ફોટો

અરજદારનું નામ

અરજદારની સહી

તારીખ

□

□

□

□

□

□

□

□

(અહીં ફોટો ચોંટાડો અને એવી રીતે સહી કરો કે તમારી સહી ફોટો તેમ જ ફોર્મ પર પણ આવે)

સહ-અરજદારનો ફોટો

અરજદારનું નામ

અરજદારની સહી

તારીખ

□

□

□

□

□

□

□

□

(અહીં ફોટો ચોંટાડો અને એવી રીતે સહી કરો કે તમારી સહી ફોટો તેમ જ ફોર્મ પર પણ આવે)



ઉજ્જવન સ્મોલ ફાઇનાન્સ બેંક

ઉત્તમ જીવન નું નિર્માણ

વધારાનું સહ-અરજદાર ફોર્મ

કૃપા કરીને માત્ર કેપિટલ અક્ષરો અને કાળા રંગની બોલપેનથી માહિતી ભરો

□ □ □ □ □ □ □ □ □ □ □ □ □ □ □ □

વ્યક્તિગત વિગતો (વ્યક્તિગત)

અરજદાર સાથેનો સંબંધ _____

નામ

જાતિ ☐ પુરુષ ☐ સ્ત્રી ☐ ટ્રાન્સજેન્ડર

પિતાનું નામ

માતાનું નામ

માતાનું પ્રથમ નામ

જીવનસાથીનું નામ

જન્મતારીખ

વૈવાહિક સ્થિતિ ☐ અવિવાહિત ☐ વિવાહિત ☐ વિધવા ☐ છૂટાછેડા ☐ અલગ થયેલ

રાષ્ટ્રીયતા ☐ ભારતીય ☐ NRI ☐ અન્ય _____

ધર્મ ☐ હિંદુ ☐ મુસ્લિમ ☐ શીખ ☐ ખ્રિસ્તી ☐ પારસી ☐ બૌદ્ધ ☐ જૈન ☐ અન્ય _____

વર્ગ ☐ SC ☐ ST ☐ OBC ☐ સામાન્ય ☐ અન્ય ☐ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ

ઉચ્ચત્તમ શૈક્ષણિક અભ્યાસ

પાન નંબર

☐ UID નંબર _____ જારી કર્યાની તારીખ

☐ VID નંબર _____ જારી કર્યાની તારીખ

☐ પાસપોર્ટ નંબર _____ સમાપ્તિ તારીખ

☐ ડ્રાઇવિંગ લાઇસન્સ _____ સમાપ્તિ તારીખ

પ્રવર્તમાન સરનામું ☐ અરજદારને સમાન

ધર નંબર

માર્ગ/વિસ્તાર

શહેર

જિલ્લો

રાજ્ય

પિનકોડ

ધરનો પ્રકાર ☐ માલિક ☐ લીઝ પર ☐ ભાડે રહેઠાણના વર્ષો

મોબાઇલ નંબર

કાયમી સરનામું ☐ અરજદારને સમાન ☐ સંદેશાવ્યવહાર માટે પસંદગીનું સરનામું

ધર નંબર

માર્ગ/વિસ્તાર

સીમાચિહ્ન

શહેર

જિલ્લો

રાજ્ય

પિનકોડ

ધરનો પ્રકાર ☐ માલિક ☐ લીઝ પર ☐ ભાડે

મોબાઇલ નંબર

રોજગારીનો પ્રકાર ☐ સ્વરોજગાર ☐ પગારદાર ☐ વેતન પરના કામદાર ☐ કોન્ટ્રાક્ટ પર કામદાર ☐ ખેતી

વ્યવસાયની વિગતો – સહ-અરજદાર

વ્યવસાયનો વર્ગ* ☐ પગારદાર ☐ કારોબાર ☐ વ્યાવસાયિક ☐ નિવૃત્ત ☐ ખેડૂત ☐ અન્ય

રોજગારદાતા / કારોબારનું નામ*

સરનામું લાઇન 1*

સરનામું લાઇન 2*

સરનામું લાઇન 3*

વિસ્તારનું નામ

શહેર/ નગર/ ગામ*

જિલ્લો*

પિનકોડ*

ફોન નંબર (STD કોડ સાથે) -

ઇમેઇલ ID* (સત્તાવાર)

જો પગારદાર તો* ☐ કેન્દ્ર / રાજ્ય સરકાર ☐ પ્રાઇવેટ લિમિટેડ ☐ પબ્લિક લિમિટેડ ☐ જાહેર ક્ષેત્રની કંપની ☐ શૈક્ષણિક સંસ્થા

☐ MNC ☐ પ્રોપ્રિએટર/ ભાગીદારી ☐ અન્ય

હોદ્દો

પ્રવર્તમાન કાર્યનો અનુભવ Y Y M M કુલ કાર્યનો અનુભવ Y Y M M

જો કારોબાર તો* ☐ વેપારી ☐ ઉત્પાદક ☐ હોલસેલર ☐ સેવા પ્રદાતા ☐ અન્ય

જો વ્યાવસાયિક* ☐ ડોક્ટર ☐ CA/CWA/CS ☐ આર્કિટેક્ટ ☐ વકીલ ☐ અન્ય

કારોબાર/ વ્યવસાય શરૂ થયાની તારીખ

એન્ટિટીનો પ્રકાર* ☐ પ્રોપ્રિએટરી ☐ ભાગીદારી ☐ LLP ☐ પ્રાઇવેટ લિમિટેડ ☐ પબ્લિક લિમિટેડ ☐ ટ્રસ્ટ ☐ સોસાયટી ☐ HUF ☐ વ્યક્તિગત

(કારોબાર/વ્યાવસાયિક)

સંદેશાવ્યવહારનું સરનામું* ☐ પ્રવર્તમાન ☐ કાયમી ☐ ઓફિસ

GST સાથે નોંધણી પામેલ ☐ હા ☐ ના

જો હા તો, GSTIN

ઘોષણાં

- 1) લોન મંજૂરી ઉજ્જવળ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ (હવે પછી “બેંક”)ના એક માત્ર વિવેક પર આધાર રાખે છે. બેંકે કોઈ પણ કારણ આપ્યા વિના મારી/અમારી અરજીને નામંજૂર કરી શકે છે. બેંક મારી/અમારી વધુ ધિરાણની આવશ્યકતાને ભંડોળ પૂરું પાડવા માટે બાધ્ય નથી. જ્યાં સુધી હું/અમે લાગુ થવા પાત્ર નિયમો અને શરતોનું માલન ન કરીએ ત્યાં સુધી, મંજૂર થઈ હોવા છતાં પણ બેંકે લોન ડિસ્બર્સ કરવી આવશ્યક હોતી નથી.
- 2) હું/અમે નિયમો અને શરતો તથા લોનને સંચાલિત કરતા શુલ્ક અને ફી દ્વારા બાધ્ય રહીશું. હું/અમે બેંક સમયાંતરે નિર્ધારિત કરી શકે એવા નિયમો અને શરતોથી પણ બાધ્ય હોઈશું. બેંક પોતાના વિવેકથી પોતાના વિવેકથી સમયાંતરે પ્રકાશ અને શરતો, શુલ્ક અને ફી સમયાંતરે બદલવા, સુધારવા અથવા ફેરફાર કરવા માટે અધિકૃત છે અને બેંકની વેબસાઇટ (www.ujjivansfb.in) પર અને/અથવા કોઈ શાખા પર પ્રકાશિત કરવામાં આવતી તમામ ઘટનાઓ મારા/અમારા માટે પર્યાપ્ત સૂચના હશે અને હું/અમે તેનાથી બાધ્ય રહીશું.
- 3) લોન જે ઉદ્દેશ માટે આપવામાં આવી હોય તેનો ઉપયોગ તેના માટે કરવાનો રહેશે.
- 4) હું/અમે વાસ્તવિક માલિક/સંયુક્ત અથવા ઘણા માલિક છીએ અને હું/અમે અહીં ઉલ્લેખ કરેલી સ્થાવર સંપત્તિનો સંપૂર્ણ કબજો ધરાવીએ છીએ. હું/અમે જણાવેલી સંપત્તિ માટે મારી/અમારી સ્પષ્ટ, માન્ય, માર્કેટિંગ યોગ્ય અને બોજ વિનાના શિર્ષક અંગેના પૂરતા દસ્તાવેજ પુરાવા રજૂ કરીને બેંકને ખાતરી આપીશું.
- 5) હું/અમે બેંકને કોઈ પણ વૈધાનિક/ નિયમનકારી સંસ્થાઓ અથવા નાણાકીય સંસ્થાઓ અથવા કેડિટ બ્યુરો/ એજન્સીઓ અથવા બેંકની પેરેન્ટ/ પેટાકંપની/ સહયોગીઓ/એસોસિએટ અથવા બેંક દ્વારા સામેલ અન્ય કોઈ ત્રાહિત પક્ષ અથવા એવા લોકો જેમની સાથે બેંક કારોબાર સંબંધ ધરાવે છે, એવા લોકો સાથે, આવશ્યક હોઈ શકે/ કાયદા, નિયમ અથવા નિયમન દ્વારા મંજૂરી આપેલ હોઈ શકે અથવા બેંક દ્વારા આવશ્યક કર્યા પ્રમાણે, મારી/અમારી અથવા મારા/અમારા ખાતા(ઓ) સંબંધિત (વ્યક્તિગત સંવેદનશીલ ડેટા/ માહિતી અને/અથવા અન્ય કોઈ માહિતી, જેના માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ધારા, 2000 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (વ્યાજબી સુરક્ષા પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ તથા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા અથવા માહિતી) નિયમ, 2011 અને/અથવા અન્ય કોઈ કાયદા) હેઠળ સંપત્તિની આવશ્યકતા હોય એવી અન્ય કોઈ માહિતી) કોઈ પણ અથવા તમામ માહિતી અને ડેટા, પછી તે મારા દ્વારા પૂરા પાડવામાં આવ્યા હોય અથવા અન્યથા, તેમનું આદાન-પ્રદાન, આપ-લે, જાહેર અથવા અલગ કરવા માટે અધિકૃત કરે છું અને હું/અમે બેંક અથવા તેના એજન્ટ્સ/ પ્રતિનિધિઓ/ કર્મચારીઓને આવી માહિતીનો ઉપયોગ કરવા/ આપ-લે કરવા માટે જવાબદાર ઠેરવીશું નહીં.
- 6) લેખિતમાં જાહેર કરેલ દરે સિવાય, હું/અમે નિર્દેશક અથવા બેંક અથવા અન્ય કોઈ બેંક કે વરિષ્ઠ અધિકારીના નિર્દેશકના સંબંધી અથવા બેંકના વરિષ્ઠ અધિકારીના સંબંધી નથી કે બેંકના કોઈ નિર્દેશક અથવા કર્મચારી અથવા વરિષ્ઠ અધિકારી અથવા તેમના સંબંધી મારા/અમારા દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિમાં કોઈ નોંધપાત્ર હિત ધરાવતા નથી.
- 7) હું/અમે ડિક્લોલ્ટર/ ઇચ્છાપૂર્વક ડિક્લોલ્ટર નથી અથવા ડિક્લોલ્ટર/ ઇચ્છાપૂર્વક ડિક્લોલ્ટર તરીકે જાહેર કરવા માટેની કોઈ કાર્યવાહીનો સામનો કરી રહ્યા નથી અને જો કોઈ ધિરાણકર્તા મને/અમને ઇચ્છાપૂર્વકના ડિક્લોલ્ટ જાહેર કરવા માટે કોઈ કાર્યવાહી શરૂ કરે છે અથવા ધમકી આપે છે તો બેંક મારી/અમારી સામે યોગ્ય કાર્યવાહી લેવાનો અધિકાર ધરાવશે.
- 8) બેંક અથવા તેના એજન્ટ્સ દ્વારા ટેલિફોન/ મોબાઇલ/ એસએમએસ/ ઇ-મેઇલ મારફતે વ્યવહાર, પ્રમોશન તેમ જ સેવા સંબંધિત કોલ્સ અથવા મેસેજિસ માટે મારા/અમારા સંપર્કના નંબર/ઇ-મેઇલ આઈડીનો ઉપયોગ કરવા માટે બેંક અધિકૃત છે.
- 9) જો અહીં મારા દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતોમાં કોઈ ફેરફાર થાય છે તો હું/અમે બેંકને ટેકો આપતા પુરાવાની સાથે આવા ફેરફાર થયાના 2 (બે) સપ્તાહની અંદર આવા ફેરફાર અંગેની લેખિતમાં જાણ કરી શું અને ત્યાર સુધી બેંકે લોનને સંબંધિત અહીં પૂરી પાડેલી માહિતીને સ્વીકારવા માટે અધિકૃત છે.
- 10) ઉપર પૂરા પાડેલા મોબાઇલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ મારા/અમારા વિશેષ નિયંત્રણમાં છે.
- 11) બેંક ડુ નોટ કોલ રજિસ્ટ્રીઝમાં મારા/અમારા સંપર્ક નંબર ડિ-રજિસ્ટર કરવા માટે અને મારા/અમારા સંપર્ક નંબરની ડીએનડી સ્થિતિ નિષ્ક્રિય/ડિ-રજિસ્ટર કરવા માટે પણ અધિકૃત છે. હું/અમે એ બાબતથી પણ જાગૃત છીએ કે હું/અમે બેંક ડીએનડી/એનડીએનસી સ્થિતિને નિષ્ક્રિય/ડિ-રજિસ્ટર કર્યા પછી મારા/અમારા વિવેક પર કોઈ પણ સમયે ડીએનડી/એનડીએનસી માટે પુનઃનોંધણી કરવાનો અધિકાર અને વિકલ્પ ધરાવીએ છીએ.
- 12) જો લોનની અરજી નામંજૂર થાય અથવા જેના માટે અરજી કરવામાં આવી છે તે લોન (જો મંજૂર કરેલ હોય) સમાપ્ત થાય તો બેંક અરજી સાથે મારા/અમારા દ્વારા રજૂ કરેલા ફોટોગ્રાફ અને દસ્તાવેજ મને/અમને પરત કર્યા વિના તેમને પોતાની પાસે રાખવા માટે અધિકૃત છે.
- 13) ઉપર સ્પષ્ટ કરેલી દરેક અને એક માહિતી મારા/અમારા સાથે સંબંધિત છે અને તે તમામ પાસાઓમાં સાચી, ખરી અને સંપૂર્ણ છે અને મેં/અમે કોઈ પણ માહિતી છુપાવી નથી. હું/અમે બેંકની વિનંતી પર, આવા વધુ દસ્તાવેજો, માહિતી, બાબતો અને વસ્તુઓ રજૂ કરીશું, જે બેંકને આવશ્યક લાગી શકે. હું/અમે મારા/અમારા પક્ષે કોઈ બેરેકરારી/ ભૂલ અથવા મારા/અમારા પક્ષે કોઈ લાગુ થવા પાત્ર નિયમ અને નિયમનો અને/અથવા નિયમો અને શરતોનાં પરિણામ કસ્ટોડી અથવા બેંકને મારા/મારા સંબંધિત કોઈ ખોટી અથવા અપૂર્ણ માહિતી પૂરી પાડવાને લીધે દરેક સમયે, તમામ કાર્યવાહીઓથી અને સામે, માગણી, નુકસાન, ખર્ચ અથવા વ્યય, જે બેંકને કોઈ પણ સમયે થયા હોઈ શકે અથવા થાય છે તેના માટે બેંક, તેના સહયોગીઓ, નિયુક્ત ઉત્તરાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને ક્ષતિપૂર્તિ કરીશું અને કરતા રહીશું.
- 14) આધારના ઉપયોગ માટેની અધિકૃતતા
 - o (બાયોમેટ્રિક માટે): હું/અમે બેંક સાથે ખાતું ખોલવા અથવા સૂચનાઓની પ્રક્રિયાના ઉદ્દેશ માટે યુઆઈડીએઆઈની માર્ગદર્શિકા અનુસાર અથવા સમયાંતરે લાગુ કોઈ ધારા કે કાયદા અનુસાર સ્વીકાર્ય હોય એ રીતે મારી/અમારી ઓળખ સ્થાપિત કરવા માટે યુનિ અને એન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (“યુઆઈડીએઆઈ”) સાથે પ્રમાણીકરણ કરવા માટે મારા આધાર નંબર અને બાયોમેટ્રિક માહિતીનો ઉપયોગ કરવા માટે બેંકને મારી સ્વૈચ્છિક સંમતિ આપું છું. બેંકે મને/અમને જણાવ્યું છે કે મારા/અમારા આધાર નંબર અને બાયોમેટ્રિક માહિતી જ્યાં સુધી કાયદા દ્વારા આવશ્યક કરવામાં અથવા મંજૂરી આપેલ ન હોય ત્યાં સુધી અન્ય કોઈ ઉદ્દેશ માટે બેંક દ્વારા સંગ્રહિત/ આપ-લે/ ઉપયોગ કરવામાં આવશે નહીં. હું/અમે મારી/અમારી ઓળખ સ્થાપિત કરવા માટે ઉપલબ્ધ અન્ય રીત અંગે જાગૃત છું એટલે કે આધારની ઓફ-લાઈન ખરાઈ, પાસપોર્ટના અથવા અન્ય કોઈ સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજના ઉપયોગ. હું/અમે વધુ પુષ્ટિ કરું છું કે આધાર મારફતે મારા/અમારા દ્વારા રજૂ કરેલ માહિતી સાચી અને ખરી છે અને હું/અમે મારા/અમારા દ્વારા પૂરી પાડેલી કોઈ ખોટી માહિતી માટે બેંકને જવાબદાર ઠેરવીશું નહીં.
 - o (આધારની ફિઝિકલ કોપી માટે): હું/અમે અહીં જાહેર કરીએ છીએ કે મેં/અમે બેંકમાં મારી/અમારી આધાર કાર્ડ/ઇ-આધાર સ્વૈચ્છિક રીતે રજૂ કર્યું છે અને બેંકને મારી/ઓળખ અને/અથવા સરનામાંના પુરાવા તરીકે તેનો ઉપયોગ કરવા માટે વિનંતી અને અધિકૃત કરી છે.


15) સેન્ટ્રલ કેવાયસી

હું/અમે બેંકને સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી અંગે ઉપર પૂરી પાડેલી વિગતો અપલોડ કરવા માટે અધિકૃત કરીએ છીએ. હું/અમે બેંકને કેવાયસી નંબરને આધારે સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી પાસેથી મારી/અમારી કેવાયસી વિગતો ડાઉનલોડ કરવા માટે પણ અધિકૃત કરીએ છીએ

“હું/અમે ઉજ્જવન સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડને વ્યવહાર/પ્રોત્સાહન/સેવા કોલ્સ/ મેસેજિસ માટે ફોર્મમાં ઉલ્લેખ કરેલ મારા/મારા સંપર્ક નંબરનો ઉપયોગ કરવા માટે અધિકૃત કરીએ છીએ.”

□ ୧୮ □ ୧୯


સહ-અરજદારનો ફોટો



અરજદારનું નામ

અરજદારની સહી

સહ-અરજદારનો ફોટો



તારીખ

D	D	M	M	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---

લોન અધિકારી										એમ્પ્લો. ID: UJJ										
લોન અધિકારી										એમ્પ્લો. ID: UJJ										
કારોબાર તરફથી મંજૂર કરનાર										એમ્પ્લો. ID: UJJ										
ક્રેડિટ તરફથી મંજૂર કરનાર										એમ્પ્લો. ID: UJJ										

નોંધ: આ ફોર્મ વિકાસ લોન એપ્લિકેશન ફોર્મનું એક પરિશિષ્ટ છે.